



MAW-001-001371

Seat No. _____

B. A. (Economics) (Sem. III) (CBCS) Examination

October / November – 2016

Paper - V : Macro Economics - I

(Elective - I) (Old Course)

Faculty Code : 001

Subject Code : 001371

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) દરેક પ્રશ્નના ગુણ સામે દર્શાવવામાં આવ્યા છે.
(૨) પ્રશ્નોના જવાબ આંતરિક વિકલ્પના આધારે આપો.

- | | | |
|---|---|----|
| ૧ | ભારતમાં રાષ્ટ્રીય આવકના નીચા વૃદ્ધિ દરના કારણો જણાવો. | ૧૪ |
| | અથવા | |
| ૧ | કેઈન્સનો અસરકારક માંગનો સિદ્ધાંત સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. | ૧૪ |
| ૨ | વ્યાજનો સમય પસંદગીનો સિદ્ધાંત સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. | ૧૪ |
| | અથવા | |
| ૨ | ગુણકનો ખ્યાલ સમજાવો. ગુણકની પ્રક્રિયા સમજાવો. | ૧૪ |
| ૩ | મૂડીની સીમાંત કાર્યક્ષમતા નક્કી કરતાં પરિબળો ચર્ચો. | ૧૪ |
| | અથવા | |
| ૩ | વપરાશવૃત્તિ પર અસર કરતાં પરિબળો ચર્ચો. | ૧૪ |
| ૪ | સરેરાશ અને સીમાંત બચતવૃત્તિનો ખ્યાલ સમજાવો. તે બંને વચ્ચેનો સંબંધ તપાસો. | ૧૪ |
| | અથવા | |
| ૪ | વપરાશવૃત્તિ વધારવાના ઉપાયો જણાવો. | ૧૪ |
| ૫ | ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)
(૧) રાષ્ટ્રીય આવકના અંદાજોની ઉપયોગિતા
(૨) GDP અને GNPના ખ્યાલ સમજાવો.
(૩) વપરાશ વિધેય
(૪) વ્યાજનો આત્મ સંયમનો સિદ્ધાંત સમજાવો. | ૧૪ |

ENGLISH VERSION

- Instructions :** (1) Figures in the right side indicate marks.
(2) Give answer question on the basis of internal option.

- 1 Explain the causes of low growth rate of national income in India. 14

OR

- 1 Explain the effective demand theory of Keynes. Evaluate it. 14

- 2 Explain time preference theory of interest. Evaluate it. 14

OR

- 2 Explain the concept of multiplier. Explain the process of multiplier. 14

- 3 Discuss factors determining marginal efficiency of capital. 14

OR

- 3 Discuss the factors determine the propensity to consume. 14

- 4 Explain the concepts of average and marginal propensity to saving. Examine the relationship between them. 14

OR

- 4 Give the measures to increase propensity to saving. 14

- 5 Write short notes : (any two) 14

- (1) Usefulness of estimation of National Income
- (2) Explain the concept of GDP and GNP
- (3) Consumption function
- (4) Explain abstinence theory of interest.